https://archive.org/details/bk1064/page/n0/mode/1up
-Ukheda Laxminarayan Inauguration (1064)
All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

KJ-BK-4-36

॥ ૐ ॥

ઉખરડા.

ભગવાન લક્ષ્મીનારાયણ પાન મુર્તિ પ્રતિષ્ઠા. વખતે પયેલ કાર્ય ક્રમ નો. નોંધ.

realpatidar.com

https://archive.org/details/bk1064/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1064/page/n2/mode/1up
-Ukheda Laxminarayan Inauguration (1064)
Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 17:28:39 +05'30'

KJ-BK-4-36

realpatidar.com

।ॐ।

ઉખરડા.

ભગવાન લક્ષ્મીનારાયણ પાન મુર્તિ પ્રતિષ્ઠા.
વખતે પધેલ કાર્ય ક્રમ નો. નોંધ.

realpatidar.com

https://archive.org/details/bk1064/page/n3/mode/1up
-Ukheda Laxminarayan Inauguration (1064)

KJ- BK- 4- 37

realpatidar.com

ॐ ઉખરડા તા. ૨૧-૫-૭૫.

જાહેર મીટીંગ. સમય:— ૮ થી ૧૧ રાતના.

પ્રમુખની દરખાસ્ત મુકનાર:— શ્રી મુળજી ભાઈ શીવજી જોંભડી વાળા

ટેકો આપનાર:— " માવજી ભાઈ ધનજી નખત્રાણા વાળા.

પ્રમુખ:— " માવજી ભાઈ નાનજી ઉખરડા વાળા.

માવજી ભાઈ ધનજી નખત્રાણા.

આપણે બધા અહીં ભેગા થવાનું કારણ જણાવ્યું હતું અને વોલીન્ટીઅરોની શું ફરજ છે તે સમજાવેલ હતું. ત્યાર બાદ નીચે મુજબ વોલીન્ટીઅરોની કાર્ય વેંચણી કરી જણાવેલ હતી. ૧-રસોડા ખાતે- ઉખરડાના જણ ૧૮ ૨-મંદીર ની ઓરડી કરનાર વાંશાણી તથા નખત્રાણાના વોલીન્ટીઅર ભાઈઓ ૩-આવનાર ભાઈઓની સ્વાગતા કરનાર- જોંભડી તથા કોટડા ના ભાઈઓ- તેમની મદદ માં કાદીઆયની ટુકડી કામ કરે- આ પ્રમાણે કાર્યની વેંચણી કરી. ને કહ્યું હતું કે કોઈ પણ ભાઈઓને મુંઝવણ ઉભી થાય નહિ આપણી યુવકોની ફરજ સેવા કરવાની છે. શાંતિથી સમજાવી ખોટી તકરારો થવા દેવી નહિ પોતાના કાર્ય દરમ્યાન કદાચ દુઃખ પડે તો પણ સહન કરી લેવું વિશેષમાં સનાતન ધર્મ વિષે તથા કેળવણી વિષે સારી ચર્ચા કરી હતી અને આપણે નાનાં મોટાં દરેક ગામોમાં સ્કુલો ખોલી આપણી ભાવિ પ્રજાને સારસ શિક્ષણ આપવા સમજાવેલ હતું. જો કોઈ ગામના ભાઈઓને પોતાના ગામની સ્કુલ માટે થોડી ઘણી ધનની મદદ જોઈતી હશે તો પણ અમારો મુંબઈ સમાજ કરશે એમ જણાવેલ હતું વિશેષમાં આપણી અશાંતતા વિષે કાદીઆયના વેપારીનો અનુભવ વિષે દાખલો આપેલ હતો.

રણમલ માવજી ઉખરડા.

વોલીન્ટીઅર ભાઈઓ જે સેવા આપી રહેલ હતા તેબદલ આભાર માનેલ હતો. તથા શાંતિ જાળવા વિષે સુંદર વિવેચન કરેલ હતું. ક્ષમા વિષે બિહારી અને મહારાજનો દાખલો આપેલ હતો. જેમ દેહનું ભૂષણ વસ્ત્રો છે તેમ વીરનું ભૂષણ ક્ષમા છે ક્ષમા એજ આપણું કર્તવ્ય માનવું

realpatidar.com

રતનસીં નારાણ જોંભડીવાળા.

આજની સભા જોઈ આનંદ વ્યક્ત કરેલ હતો. અત્યારે આપણી જ્ઞાતીમાં ગામે ગામ અને ઘરેઘર જાગ્રતી આવી ગયેલ છે તેનું કારણ ઈશ્વરની જ પ્રેરણા છે દરેક ઠેકાણે આપણું કાર્ય નિર્વિઘ્ને થતું જાય છે તે ઈશ્વર ની સહાયતા થીજ થાય છે. વિશેષમાં આવનાર ભાઈઓને જણાવેલ હતું કે આપણે અહીં આનંદ કરવા આવેલ નથી પરંતુ સેવા કરવા આવેલ છીએ તો સર્વે યથા શક્તિ સેવા કરશું એમ જણાવેલ હતું.

https://archive.org/details/bk1064/page/n4/mode/1up
-Ukheda Laxminarayan Inauguration (1064)

KJ-BK-4-38

realpatidar.com

આપણી જ્ઞાતિમાં હજુ ઘણા ભાઈઓ અજ્ઞાનતામાં ઘોરે છે ત્યાં સુધી આ પગને બંધીને બેસવાનું નથી. આપણી ફરજ શ્રી માવજી ભાઈ સમજાવી ગયા છે. તે પ્રમાણે વર્તન રાખવાનું સુચવેલ હતું. વિશેષમાં આપણો ઈતિહાસ શું કહે છે. અને આપણે કોણ છીએ તે સમજાવેલ હતું. તથા આપણે આપણા ધર્મ ક્યારથી ભુલ્યા અને ક્યાં સુધી તે પણ સમજાવેલ હતું. વિશેષમાં પીરાણાપંથીઓના ગુરૂ ઈમામશા શું ભાંખી ગયા છે તે સમજાવેલ હતું. આપણી જ્ઞાતીમાં અમુક પીરાણા પંથી આગેવાનો પીરાણા પંથી નહિ પણ મજુરા પંથી એટલે કે પૈસાના ભુખ્યા છે. પૈસા એજ તેઓનું પીરાણું એજ ધર્મ છે. અને ધર્માદા પૈસાનો ગેરઉપયોગ એજ તેઓનાં ધર્મ કર્યો છે જે આજે આપણે નજરે નિહાળી રહેલા છીએ. આપણને ગણા બોકો ભોળા કહીને સંબોધે છે તેનું કારણ આપણી જ્ઞાતિમાં ભગારામ નામના એક મહાન પંડિત થઈ ગયા છે. જેમણે પોતાની વિદ્યા બદલ. ૩૦૦ આંકમેળવેલ હતા. વિગેરે બોલી પોતાને સ્થાને બેસી ગયા હતા.

મારાજ શ્રી. દયાલ દાસજી.

આપી પહેલાં બોલી જનાર ભાઈઓને અનુમોદન આપતાં જણાવેલ હતું કે આપણને આગે કુચ કરવાની છે. આપણે કંઈ ધર્મમાં પલટો કરતા નથી. ગઈ વસ્તુ હાથ કરીએ છીએ ભુલી ગયેલ ધર્મનો અંગીકાર કરીએ છીએ આપણી રગેરગમાં હિન્દુત્વ ભરેલું છે ધર્મ તથા દેશને માટે ઘણા લોકોએ પોતાના બલીદાન અર્પી દીધેલ છે જેઓનાં અમર નામ હજુ પણ ઈતિહાસે વંચાય છે જ્યારે આપણું કાર્ય તો નિર્વિઘ્ને થતું જાય છે. તો તે કાર્યમાં જોડાવાની આપણી દરેકની ખાસ ફરજ છે પ્રભુને આપણે પથ્થર મંદિરમાં નહિ પરંતુ આપણા હૃદય મંદિરમાં પધરાવી હૃદયને મંદિર જેવું પવિત્ર રાખશું ત્યારે જ આપણે સનાતની કહેવાશું. વીગેરે ધાર્મિક વિષયો ચર્ચી બેસી ગયા હતા.

શ્રી. રતનશી ભાઈ ખીમજી વીરાણી. ધાબા.

આપણે અહીં સેવા કરવા આવેલ છીએ અને સેવા એજ આપણું કર્તવ્ય સમજશું તોજ કાર્ય થઈ શકશે. આ કાર્યમાં યુવકોની ખાસ જરૂર છે. માટે યુવક ભાઈઓ સુંદર ફાળો આપશે એમ ઈચ્છું છું સ્વયંસેવકોને ખાસ સુચના કરૂં છું કે આપણી ફરજ પચ પહેરીને બેસી રેવાની નથી પણ નાનામાં નાના અને રંકમાં રંક માણસ હોય તેની પણ સેવા કરવી. અત્રે પધારેલ ભાઈઓ આપણાં માતા અને પીતા ગણવાનાં. આપણી જ્ઞાતીમાં આટલી બધી જાગ્રતી આવેલ છે તે સમાજસેવાઓની સેવાથીજ તમારી જ્ઞાતીના નાનામાં નાના બાળકની પણ તમે સેવા કરજો સેવા શબ્દ બેરુક કહ્યો. બોલી જવું સહેલ છે પણ તે કરવાનું ભાગ્ય કોઈકનેજ પ્રાપ્ત થાય છે. તમારી ટુકડીઓ જુદે જુદે ગામથી આવેલી છે

realpatidar.com

KJ-BK-4-39

realpatidar.com

પરંતુ તમારામાં જુસ્સો એક છે. અને સર્વે એક છીએ એમ સમજુ ને કામ કરશે આપણું આ કાર્ય આરતી જડપથી આગળ વધવાનું કારણ આપણી અડગ સેવા જ છે. જોગણી માં શરૂઆત માં સનાતની ભાઈઓ ના ૭ ઘર હતાં જ્યારે આજે ૫૦થી પર ઘર બીજાં જોડાવા માગે છે તેનું કારણ એ પણ્રી નીખાલસ સેવા છે. આપણે આપણાં જુના મતનાં અજ્ઞાન ભાઈબ્હેનોને આપણી સેવાથી જરૂર પરાકાશે લાવીશું. બળજબરી થી કોઈ માને નહિ પણ પ્રેમથી ઉધ્ધાર માને છે. આપણે પણ એજ પંથમાં હતા પરંતુ પ્રભુએ જેમ આપણને પ્રેરણા કરી છે તેમ ઉધ્ધારને પ્રેરણા કરશે. આર દિવસ મોડા કે વેલા પણ એ પાપી પંથનો ત્યાગ તો કરશે જ. આગળા નો અનુભવ સારો બતાવે કે હીજતા વેલા હતા. અનેજીવાજ ભાઈઓને જણાવેલ હતું કે તમારા પૈસાની કંઈક કિંમત આંકો તમારી ધર્માદા રકમ તમારાજ ભાઈઓને પાછા પાડવામાં ખર્ચનારા નહિ સૈયદોએ આપણને કેવી રીતે પોતાની જાળમાં ફસાવ્યા હતા તે કેહી બતાવ્યું હતું. તથા ધર્મના કામમાં ઉદાર એકેઠાઈ રહેવા સમજાવેલ હતું. આપણામાં સંગઠન હશે તો આપણાં દરેક કાર્યો સફળ થશે. પીતા પુત્ર વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ તે વિષે રામ અને દશરથ નું દ્રષ્ટાંત આપેલ હતું. જ્યારે આપણામાં આજે માપિતા અને સંતાનો વચ્ચે કેવો પ્રેમ છે તે કેહી બતાવ્યો હતું. આપણને ભાષણો કરવામાં કોઈ પણ આડા આવી શકે તેમ નથી છતાં પણ તે માટે આપણી ધર્માદા રકમમાંથી હજારો કેટલીઆ ધુમાડો થાય છે તેઓ અફસોસ થાય છે. કચ્છમાં ગોરેઓની પૈસા લુંટનાર અમુક ટોળકી છે અને ને આપણી ભાવાળુ જ્ઞાતિને લુંટી જાય છે છતાં પણ તેઓ પાસેથી જાગૃ લેવા જેટલો રાકતી. પૈસા આપનાર આંધી કોઈની નથી તેથી અફસોસ થાય છે મારાં ભાઈ બ્હેનોને ખાસ વિનંતી છે કે આપણી ખાસ સભાતો આવતી કાલે શરૂ થાય છે તો આપ સર્વે જરૂર પધારશો. એવી આશા રાખું છું ખાસ બ્હેનોને ખાસ વિનંતી કરું છું કે તમો તમારે ધર્મ કદાપી ચુકશો નહિ ધર્મનું કાર્ય પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સરળતાથી સાધી શકે છે. આજે સમાજનું કાર્ય પુરુષોથી ચાલી રહેલ છે તે કદાપી પાછું પડવાનું નથી અને પડશે પણ નહિ પ્રભુને મંદીરમાં પધરાવો ત્યારે પ્રતિજ્ઞાઓ લેજો કે પુરુષો કદાચ ધર્મ ચુકશે તો તેઓને પણ ચુકવા દેશું નહિં. સ્ત્રીઓનાં મહત્વ વીષે આપણને કોઈ કંઈ કથન બોલે તો. ખોટું લગાડવું નહિ વોલીન્ટીઅરો ને બે દિવસ સુધી. પોતાના કોરન ને પોતાનો માલીક સમજુ ને તેમની આજ્ઞા પાળવા નું સમજાવેલ હતું. અને ગામનાં દરેક ભાઈ બ્હેનો એક મતે કાર્ય કરશું એમ જણાવેલ હતું.

અરજનુ.

KJ-BK-4-40

realpatidar.com

શ્રી. પ્રેમજી માવજી ઉખેરડા વાળા.

આજે ઉપરના ભાઈઓએ સેવા કરી રહેલ છે તેઓનો આભાર માનેલ હતો.

શ્રી. મુળજીભાઈ શીવજી ખોંભડી વાળા.

આપણે આપણી ફરજ બરાબર સમજી ગયેલ હશું. આજરૂરતાં આવતી કાલે આપણા બંધુઓ ખાસ વધારે પ્રમાણમાં આવશે તો આપણે આપણી ફરજ બજાવવામાં જરાપણ ઢીલ કરીશું નહિ આપણે જે ગામમાં કામ કરતા હોઈએ તે જ ગામના સમજુને સેવા કાર્ય કરવું અમારા ગામ ખોંભડીમાં આજે વીસ વરસથી. સનાતની ભાઈઓનાં. સાતજણાર હતાં જ્યાં તમારી સેવાથી. આપણે પરમ દિવસે લગભગ. પચ ઘર ધરશે એવી આશા છે. આપણી સમસ્ત જ્ઞાતિ એકાર બેધરસમાં જરૂર સુધારા પર આવી જશે. આ પહોંચ દરકે ભાઈઓ પર માયાળુ દ્રષ્ટી રાખવી. હવે સમય ઘણો વ્યતીત થયો છે તથા આવનાર બંધુઓને થાક પણ લાગ્યો હશે. એટલે આજની સભા સમાપ્ત કરીએ છીએ કેમકે આપણી કાલની સભામાં વધારે સુંદર રીતે. કાર્ય થઈ શકે. =ન- સભામાં આશરે ૭૦૦ માણસોની હાજરી હતી

સમાપ્ત

સમય-૧૧ વાગે રાતના.

પ્રમુખની. સહી. પા. માવજી નાનજી ની.

તા. ૨૨ — ૫ — ૪૬.

આજે સવારથી સાંજ સુધી મંદીરનાં નાકાં. અગ્ની કુંડ વગેરે બાંધવામાં આવેલ મૂર્તિનો જળયાત્રા કરાવવા, વાજતે ગાજતે લઈ જવાઈઓ ગયેલ હતા. સાંજના ૭ વાગે આવનાર ભાઈઓનાં. સામૈયાં કરવામાં આવેલ હતાં. આજે સવારમાં લગભગ ૧૦ વાગે. અહીંના પીરાણા પંથીઓના ધર્મના ખાનામાં પડેલ માંસના હાડનો રોમોમડ ફીસો હાથમાં આવેલ હતો જાહેર બોર્ડમાં લખેલ છે કે હિંદુ સિવાય કોઈને અંદર દાખલ થવું નહિ જ્યારે અંદર મુસલીમ અમલદારો માંસનો આહાર કરે ~~છે~~ આવા અધિકારી પંથને દિયાનત આપવામું છે. સાંજે ૮ વાગે ભોજન કાર્યથી નિવૃત થઈ સભા કાર્ય શરૂ કરવામાં આવેલ હતું

realpatidar.com

https://archive.org/details/bk1064/page/n7/mode/1up

KJ-BK-4-41

realpatidar.com

જાહેર સભા. ઉખરડા તા. ૨૨-૫-૪૭.

સમય. રાત્રી. ૯॥ રાતના.

પ્રમુખની દરખાસ્ત મુકનાર – શ્રી મુળજી ભાઈ શીવજી ભાઈ ભોળાણી.

ટેકો આપનાર – શ્રી માવજી ભાઈ ધનજી ભાઈ નાકરાણી

પ્રમુખ – શ્રીયુત વાલજીભાઈ તેજુભાઈ ઉખરડાવાળા

મુળજીભાઈ શીવજી ભોળાણી દ્વારા પ્રમુખ પદ

આપ સર્વે ભાઈ ઓએ આજની સભાના પ્રમુખ તરીકે મારી ચુંટણી કરી છે. હું પ્રમુખ સ્થાન માટે યોગ્ય નથી છતાં પણ આપ ભાઈઓએ ફરજ પાડી છે તો હું મારૂ સ્થાન સંભાળું છું ને બોલનાર ભાઈઓને જે બોલે તે સાંભળનારાઓ ગ્રહણ કરશે એવી વિનંતી કરૂં છું.

શ્રી મહારાજ દયાલદાસજી. વાંઢાય.

મંગલાચરણ જય ભાઈ.

આજની મીટીંગમાં માન રતનશીભાઈએ ધાર્યું કે જાહેર કેમ બોલવાનું મારા ઉપર રાખેલ હતું તો હું કાંઈ બોલતો નથી કેમ કે જ્ઞાનમાં આપ શ્રીયુત જેઠાભાઈ જેવા પ્રખર વક્તાઓ છે તે તમો જે ધાર્મિક વિષય ઉપર બોલશે એવી આશા રાખું છું. હું મારી બુદ્ધિ અનુસાર જે બોલું તેમાં કોઈ ભૂલ થાય તો તે માટે ક્ષમા માગું છું. આપણે આપણી ઉન્નતિ પ્રેમ અને સંગઠન નથી કરી શકતા અને તેવો પ્રેમ અને સંગઠન નહિ તેની ભાવના આપણા મનમાં કાંઈક આનંદ થાય છે. આપણે આપણી જ્ઞાતિ પ્રભુને પધરાવતી વખત તેઓની પાસેથી એજ માગવાનું છે કે અમોને પ્રેમ અને સંગઠન આપ. આજે આ મંદિરમાં પાટ ભરાવવાથી મારૂં પ્રેમમન કુંડમાં પતાવીશ. આપણા ધર્મ પ્રેમ અને સંગઠન વધે તેમ કરવું અને તેમ કરવા વીજ આપણે આપણું ધર્મ કરીશકશું. આટલું બોલી પોતાનું સ્થાન સંભાળ્યા બાદ દર્શું. જય નારાયણ

realpatidar.com

માવજી ધનજી નાકરાણી

આપણો જ્ઞાતિના આરતાંભિગાર્ટ જેનો એકમ પદેલાં ભાઈ પરમેશ્વર આ જાંપ થાય છે અને આ આનંદ ન અનુભવે એવો અભાગીઓ કોઈક હોય. આ સ્થાને મારા લોકોમાં ભેરૂ પાસા તુટે કે જેમને શાલિના પૈસા ઉપર કરી ગયા છે આપણું આ કાર્ય સત્ય છે અને દરેકપણે પધરાવશે તેજ દિન આપણે પીરાણા પંથીઓને બુઝાવવાની ઈચ્છા છતાં પણ સમજતા નથી ખબર ક્યારે સમજે ત્યારે ખરા. પ્રભુ તો જેની વિનંતી પણ તેઓએ સ્વીકારી નથી તેઓનાં હૃદયની પેઠે જ્યોતિ. આપણી આ વીઆશા હતી કે આપણા વડીલોઆપણા કબ્જા રહે ના નહિ હોય.

https://archive.org/details/bk1064/page/n8/mode/1up

KJ- BK- 4- 42

realpatidar.com

આજે શ્રીમાન રતનશી ભાઈ અહીંના શ્રીયુત રૈયા ભાઈને ઘેરે ઉતર્યા ત્યારે તેઓના માતુશ્રી તરફથી જે પુષ્પ સમાન શબ્દો સાંભળાવવામાં આવેલ છે તેઓ ભલાં પણ મને શરમ પાવે છે ભાવીમાં રસ્તો ભુલેલા બાળકની સામે રસ્તો બતાવવાની ફરજ નથી? અલબત છેજ. ~~[illegible]~~ ઉખરડા ના બાળનાંમાં પડેલ. આપણી જ્ઞાતીની અધોગતી. ડરનાર શબ્દોમાં થડ કીસ્સો મર્મ બતાવવામાં આવેલ હતો. થયેલ રિપોર્ટની નકલ વાંચી સંભળાવેલ હતી.

જો આપણાજ આગેવાનો આવાં કૃત્યો કરશે તો કેટલો બધો. અધીમ કરે વાધ આવા કરતાં તો હિંદુ અગર મુસલીમ એકે ધર્મ સ્વીકારવો સારો ઉપરોક્ત બાબત પરથી. આપ સર્વે ખ્યાલ કરી શકશો કે આપણી જ્ઞાતિ કેટલી બધી અધોગતીએ પહોંચી ગયેલ છે. અગ્રે લગભગ બાવીસ ગામના ભાઈઓ હાજર છે. જ્યારે આ ગામના જ ભાઈઓ ત્યાં બેસી રહેતો સારું નગણાય. આપણે એ લોકો ને પગે લાગીએ છીએ છતાં પણ એ ભાઈઓ ને હજુ સુધી ગજેઘાત ઉતરતી નથી. આવાં કૃત્યો કરવા બદલ સુમના નહિ કરે એવો એ ભાવીમાં ક્યાં હોય. આ બાબતોમાં આપણે પોતાનેજ ભોગ બનાવો જોઈએ. જો આપણે આપણી ફરજ સમજશું તોજ પ્રભુને જોઈ શકીશું. આપણને સંયમ કેળવવો જોઈએ પરંતુ આપણામાં કેળવણી બીલકુલ નથી. તો પછી સંયમ ક્યાંથી જાળવી શકીએ. પોતાની કેળવણી લીધી. થશે. તેથી આ જમાનામાં આપણાં બાળકોને કેવી કેળવણીની જરૂર છે તે સમજાવેલ હતું. આપણામાં આવેલ આ જાગૃતી હવે ક્યારેય છુપશે નહિ બલ્કે દીન પ્રતિદીન ઉન્નતી સાધતી રહેશે. આપણો સમાજ ઘણા વખત બાદ જાગી ગયેલ છે. પરંતુ હવે ફરીથી છેતરાશે નહિ વિશેષમાં જણાવેલ હતું કે આપણાં બાળકો માટે ગામોગામ કેળવણી કેન્દ્રો ખોલો. જે ગામડામાં સ્કુલો ચલાવવા જેટલી શક્તિ નહિ હોય તો મુંબઈ નાગપુર વીગેરે ઠેકાણે સમાજ ~~[illegible]~~ છે. તે તરફથી પણ દાનનો પ્રવાહ વહેતો રહેશે આપણે હવે શ્રી. બેચર ભા. ભ. ખુબ સમજાવશે. એ એક ખુશીની વાત છે. આટલું બોલી. મારૂ સ્થાન સંભાળી લઉં છું.

realpatidar.com

દેવશી કાનજી ભગત દેવપર

આજનો ઉત્સવ જોઈ આનંદ થાય છે. આપણે આજે અલૌકીક વસ્તુ પાછી મેળવી રહેલ છીએ ધર્મ ક્યાં છે સંપ માં સંપ નથી ત્યાં ધર્મ નથી. કહેવત છે કે પાંચ સંપે તો ગામ કંપે અને ગામ સંપે તો રાજ કંપે જો પાંચ ભાઈઓમાં સંપ હોય તો આખું ગામ પણ તેને કંઈ કરી શકતું નથી અને ગામમાં સંપ હોય તો રાજ પણ કંઈ કરી

KJ-BK-4-43

realpatidar.com

શકુનીદિ તો આપણ ને અરસપરસ સંપ રાખવો અને તેથી સંપ મારા સમાજ ના ભાઈઓ માં જોઈ આનંદ અનુભવું છું આપણા વડીલો નરપશુ અને ગુરૂપશુ હતા. તેનો અર્થ એકે નરપશુ કોણ કે બીજાની વાત સાર અસાર જોયા વગર સાચી માની લેતે અને ગુરૂ પશું એકે જે માણસના ગુણ અવગુણ જોયા વગર ગુરૂ માની લે. આ બને અવગુણો આપણા અજ્ઞાન વડીલોમાં હતા અને આજ લગી પણ કેટલાક અજ્ઞાન ભાઈઓમાં જોવામાં આવે છે દ્રષ્ટાંત :- મહાત્મા અને વેશ્યાનું.

તો આપણે પણ આપણો ધર્માંધ પૈસો ફેંકે છે. તો આપવો તેનો વિચાર કરવો જોઈએ. દ્રષ્ટાંત પાગલ વીષે :- તો આપણે પણ પાગલ જેવા માણસને ઉપદેશ દેવો નકામો છે કારણ કે પાગલ ને ઉપદેશ દેવાથી. આપણા અમૃત સરખાં વચનો નકામાં જાય છે માટે ઉપદેશ તો સારા માણસોને દેવો દ્રષ્ટાંત :- ચાર મુરખ વીષે.

તો આપણે પણ ધ્યાન રાખવું કે આજ્ઞા કરે તેમ ન કરીએ પણ સાચા કરે તેમ કરીએ. જે ઘણા માણસો ખોટું કાર્ય કરતા હોય તો તેઓ ને સાથ ન આપવો. પણ થોડા હોય ને સાચું કરતા હોય તો તેઓની સાથે ભળવું. દ્રષ્ટાંત :- અંધેર રાજનું બીતાના અર્થ વિષે.

તો આપણા વડીલો પણ અંધ શ્રધાને લીધે આવા અંધેર પંથમાં ફસાયા હતા. પરંતુ હવે આપણને ઉપદેશકો મળેલ છે અને તેઓને પ્રભુએજ આપણો સાચો ધર્મ બતાવવા મોકલેલા છે તો આપણને હવે આપણો સાચો માર્ગ ગ્રહણ કરવા માં ઢીલ કરવી ન ઘટે. જે પ્રેમી ને પ્રેમી મળે છે તો આનંદ અને ઉત્સવ થાય છે ધર્મની વૃધ્ધિ થાય છે તેવીજ રીતે પ્રેમ વગર ની વસ્તુ કાંટા વાળા ઘાસ સમાન છે ભગવાન ના ભોગ વિષે. ભુલ ક્યારે રામજય વિગેરે બોલી પોતાને સ્થાને બેસી ગયેલ હતા.

જેઠાભાઈ હરીભાઈ મંજલવાળા.

આજનું સંમેલન જોઈ આનંદ થાય છે. અમો ઘણો વખત થયે ગુજરાત રહીએ છીએ ત્યાં આપણા જ્ઞાતિબંધુઓના શું હાલ છે તે અમે જાણીએ છીએ પરંતુ હવે આપણા સમાજ માં આટલી બધી જાગૃતી આવેલ છે એટલે અમો. ગુજરાત વાસી. આપણા બંધુઓ પાસે પણ મગરૂર બની શકીશું. અને તેઓની. હરોળ માં ઉભા રહી શકીશું ધન્ય છે જ્ઞાતિ સુધારક ભાઈઓને કે આપણને સાચો ધર્મ બતાવ્યો. હવે હું બેસી જવાની રજા લઉં છું.

શ્રી. પરબત ભાઈ લખુ મંજલવાળા.

મારાથી અગાઉ ઘણા ભાઈઓ બોલી ગયા છે શ્રી. માવજી ભાઈ ઉપદેશમાં બનેલ કીસ્સો આપ સર્વે ને સમજાવી ગયા આપણી જ્ઞાતિ તરફથી. આવી બાબતો બનતી હશે જ્યારે આપણે તે સાંખી લઈએ તે ખરેખર શરમાવા જેવું છે

https://archive.org/details/bk1064/page/n10/mode/1up

KJ-BK-4-44

realpatidar.com

મજકુર ફકીરાર સાહેબને પણ આપણા સમાજને તોડવા માટે આપણાજ જ્ઞાતિ બંધુઓ બોલાવી લાવેલ હતા. મારા એ અજ્ઞાન બંધુઓને બીજુ વખત આવું કાર્ય કરવા પ્રેરણા ન કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરૂં છું અને એ બંધુઓ પોતાની ભુલ સુધારી લેશે એમ ઇચ્છુ છું સનાતન ધર્મનો પ્રચાર કરવા બાબત. બોલી. પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

શ્રી. શીવગણ ભાઈ કાનજી 'રસલીઆ.

આપણા ધર્મને માટે આપણને ગમે તેટલાં સંકટો પડે તો પણ સહી લેવા બાબત. પારાણા જેવા પ્રપંચી પંથનો સ્વીકાર કરવાથી આપણને ગુજરાત જેવો રસાળ મુલક છોડવો પડયો. સુધારક ભાઈઓની નમ્રતાથી આજે આ પાનમાં ફુંક મારતી આવેલ છે. બીજાઓને દોષ ન આપવા બાબત. આપણો ધર્મ સાચો છે તેને કદાપી આંચ આવશે નહિ આપણને. અરસપરસ તકરાર ન કરવા બાબત. નખત્રાણા વાસી ભાઈઓનું કાર્ય નજર સમક્ષ રાખીને કાર્ય કરવા બાબત. તથા કેટલાક ગીતાજીના શ્લોકો સમજાવી. પોતાનું સ્થાન લીધેલ હતું.

શ્રી. ઉમરશાન ભાઈ જોશી. વિથોણ.

આથી પહેલાં ઘણા ભાઈઓ બોલી ગયેલ છે. જે બાબત હું બોલું તો મારી બુદ્ધિ અનુસાર આખી રાત પણ મને પુરી થાય નહિ એટલે મારૂં બોલવું હું ટુંકમાંજ બોલીશ. શ્રી યુત મૂળજી ભાઈએ જે મારી ઓળખાણ આપેલ છે તેમાં મારો પોતે વિરોધ છે. તેઓ શ્રીએ બ્રાહ્મણની ફરજ બાબત જે મત દર્શાવ્યો છે તે જ્ઞાતનો બ્રાહ્મણ હું નથી. મારો ઇતિહાસ પલીવાડ તરીકેનો સાંભળવા ઇચ્છતા હશો તો પાછળથી કહીશ. સમાજમાં બોરવાનો અમારો પલીવાડનો હકક છે પરંતુ બ્રાહ્મણ કાર્ય કરવાનો નથી કચ્છમાં નાગર કહેવાય છે તેમાં પણ બે રીતે ઓળખાય છે નાગર બ્રાહ્મણ અને નાગર ગૃહસ્થ. નાગર બ્રાહ્મણના યજમાન નાગર ગૃહસ્થ હોય છે. તેઓ બીજા પાસે કદી પણ હાથ માંડતા નથી. તમો જેવી રીતે અધોગતીનો માર્ગ છોડી ઉન્નતીને માર્ગે ગયો છો તેમ મારા જ્ઞાતિ બંધુઓ. ઉન્નતીનો માર્ગ તજી અધોગતીને રસ્તે જઈ રહેલ છે તે નજરે જોઈને અતીશય ખેદ થાય છે. આજની સભા શા માટે થએલ છે તેતો આપ સર્વે ભાઈઓ સમજી શકતા હશો. સનાતન ધર્મ શું છે અને તેના વિધિ કેવી યોજનાઓ કરવી. તેના વિચારોની આપલે કરવા માટે આજની સભા છે આથી આગાઉ શ્રી માવજી ભાઈ બોલી ગયા કે જુના મતના લોકો સાન પધાર જેવા રહ્યા છે. તેમાં એમની ભુલ છે. એ ભાઈઓ પથ્થર નથી. કારણ કે જો પથ્થર હોય તો તેમને કારીગરો જરૂર સંઘરે અને ઘાટ ઘડીને આપણા સમાજ

https://archive.org/details/bk1064/page/n11/mode/1up
-Ukheda Laxminarayan Inauguration (1064)

KJ-BK-4-45

realpatidar.com

માં ભઈ છે. તેમ મારી પણ નથી. કારણ કે મારી હોય તો તેમને હું જરૂર સુધારી લઉં. પરંતુ તેઓનો કાદવ જેવા છે. કાદવને કોઈ પણ સંઘરતું નથી કારણ કે તેની પાસે જતાંજ તેમાંથી દુર્ગંધ નીકળે છે. પરંતુ એ કાદવ પર પરદેશના પવન ઉર્ફે વાતાવરણ રૂપી થોડો થોડો વરસાદ પડવા લાગ્યો છે એટલે કાદવ એ વરસાદથી ગંદકી ધોવાઈને માટીના સ્વરૂપમાં આવી જવા સંભવ છે. એ ભાઈઓને આગ કેવા લાગત હું મતાવીનું હશે પરંતુ વિચારથી જોશે તો જણાશે કે મારું કહેવું સત્ય છે. સનાતન ધર્મ એટલે શું જે અહીં લખેલ એક કીસ્સો કે જે શ્રી. માધવજી ભાઈ વર્ણવી ગયા. તે કિસ્સો જે અહીંના સરસ્વતીના મંદિર રૂપી સ્કુલમાંજ બન્યો હોય. અને સ્કુલના માસ્તરે કે જે પોતે બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે તેઓએ પોતાની આજુપિડા પામર ભિખારી લીધેલ હોય. તો તેઓ શ્રીનો પણ ઉપરોક્ત કારણમાં સમાવેશ કરવામાં હું જરાપણ અતિશયોક્તિ માનતો નથી. વિયોગની જાગ્રતી બાબત મારા ઘણા બંધુઓ જાણવા માગતા હશે પરંતુ એ બાબત હું બોલી શકું તેમ નથી કારણ કે એ બાબત ન્યાયના મંદિરમાં પહોંચી ગયેલ છે. એટલે ત્યાં પીજ આપણે સર્વે જાણી શકીશું. સનાતન ધર્મનો ઝુંડો સદા ઉંચો છે ને ઉંચો જ રહેશે. તે કદાપી નમવાનો નથી. અને નહિ જ નમે. કારણ કે તે સત્યના જોર છે. પીરાણા પંથી ભાઈઓ આટલા દિવસ અંધારામાંજ ગોથાં ખાતા આવ્યા છે જો તે ભાઈઓ તથા તેમના આગેવાનો એમ કહેતા માગતા હોય કે અમારો પંથ હિંદુ છે તો તેઓને એટલું જ કહું છું કે એ પંથ શુધ્ધ હિંદુ નથી જ. કારણ કે તેમાં પળે પળે મુસલમીન તત્વો આવે છે. તેઓએ મુસલમાન હોત તો મુસલમાન ભાઈઓ તેને જરૂર આવકારત પરંતુ તેઓ કોઈ પણ રસ્તે રહેલ નથી. તો તેવા ભાઈઓ હજુ પણ વિચાર કરે અને સાચો માર્ગ સ્વીકારે — આપણે અજ્ઞાનતા દૂર કરવી હોય તો કેળવણીની જરૂર છે. અને મારા યુવાબંધુઓ ગામે ગામ. નિશાળો ખોલી. પોતાની ભાવી પ્રજાને સાચું શિક્ષણ આપવા માટે અનુભવિ શિક્ષકો રોકશો એમ ઈચ્છુ છું. હું આ ગામનો. મહેમાન છું એટલે. આજે કેટલીક બાબતોનું મનન કરીશ. અને આવતી કાલે સમય મળશે તો જરૂર બોલીશ.

શ્રી. રતનશી નારાણ. ખોંભડીવાલા.

અને શ્રી મુલજી ભાઈએ બોલવાની રજા માગી છે તો હું કંઈ એટલો બધો વિદ્વાન નથી છતાંપણ મારી બુધ્ધી અનુસાર જે બોલું તે ધ્યાનથી સાંભળશો એમ ઈચ્છું છું આપણે આજ ચાળીસ વરસથી સુધારક ભાઈઓ સાચો માર્ગ જણાવી રહેલ છે અને સામે રસ્તે લાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

કંઠ માળના ૬૨૬ નું કલ્પીત દ્રષ્ટાંત.

realpatidar.com

https://archive.org/details/bk1064/page/n12/mode/1up
-Ukheda Laxminarayan Inauguration (1064)

KJ- BK- 4 -46

realpatidar.com

શ્રી. પોપટલાલ રઘુરામ- ડોરેડા.

આથી અગાઉ દેવસી ભગત. સંપ વિષે બોલી ગયા તે સંપનો અર્થ તો આપણે બધાજ જાણતા હશું પરંતુ સંપનો સ્વાદ તો કોઈક વીરલા જ માણતા હશે. તમારો આમારો ધર્મ હિન્દુ છે અને શુધ્ધ સનાતન ધર્મને પંથે ચાલશો તો. ભવિષ્યમાં સંપ આના વાસે પ્રાપ્ત કરી શકશો. તમારી જ્ઞાતિમાં જે વિક્ષેપ છે તે ભલે હોય પરંતુ એક બીજાને હાનિ પહોંચે તેવું અઘટીત પગલું કદાપી ભરશો નહિ. તમો એક છો અને એક રહેશો. અજ્ઞાન ભાઈઓને પણ. ભગવાન લક્ષ્મી નારાયણ જરૂર સદ્બુધ્ધિ અર્પશે. આપણે આપણી ટેકમાં અડગ રહેશું. તો બીજાની અજ્ઞાનતા આપોઆપ પ્રભુ દૂર કરશે તે આપણે નજરે જોતા આવીએ છીએ અને હજુ પણ એવું અભિમાન ન રાખવા વિષે એક બીજા પ્રત્યે ભાવ રાખવા વિષે સમજાવેલ હતું.

શ્રી. રતનસીભાઈ ભીમજી વીરાણી વાલાર

આજની સભામાં મારી ભાઈ બહેનોની સારા પ્રમાણમાં હાજરી જોઈ એટલું તો ચોક્કસ માની શકાય કે આજે ઉખરડા ગામના અહોભાગ્ય છે કે હું એમ જુના મતના ભાઈઓને મળેલ છે. તેઓ બહુજ થોડા છે. અને ઘણી સંસ્કારી છે એટલે થોડાજ દિવસોમાં આ ગામનો અહેવાલ કંઈક જુદોજ સાંભળશું એટલું તો ચોક્કસ માનજો. મારા શરીરની અડધી મારી ઉખરડા ગામને ફાળે જાય છે કારણ કે મારી માતુશ્રીએ જન્મ આ ગામમાંજ લીધેલ છે અને હું આ ગામને ગોંદરે બાળપણમાં ખુબ ખેલ્યો છું એટલે સમગ્ર જ્ઞાતિ સેવા કરતાં આ ગામની સેવા કરવાની મારી જવાબદારી વધારે છે અહીંના કેટલાક વડીલો ને હું આજે બે ત્રણ વખત મળ્યો છું અને તેઓ તરફથી આશાભર્યો જવાબ પણ મળેલ છે કે આવતી કાલે તેમજ જરૂર કંઈક નવી નજરે પડશે આપણામાં ધર્મ પ્રત્યે પ્રેમ હશે તો આપણે જરૂર ધર્મના સડાનો નાશ કરી શકીશું ધર્મને લીધે આપણા વડીલોના વખતો આવેલા તે પણ પુષ્પવૃષ્ટિ સમજ સહન કરતાં આપણને આવડવી જોઈએ. આજેજ જ્યારે હું શ્રી. રૈયાભાઈને ઘેર

realpatidar.com

ગયો ત્યારે મને કેટલાંક કડુ વચનો સાંભળવાં પડયાં હતાં. જે તમારા માંના ઘણા ભાઈઓ જે રીતે હશે તે જોઈ શક્યા હશે. જો આવે વખતે આપણે આપણા મનનો કાબુ જોઈએ તો આપણું કાર્ય સિધ્ધ કેવી રીતે થાય શાંતિ અને સંયમ એજ આપણો ધર્મ છે. એમ સમજશું ત્યારેજ આપણે આગળ વધી શકશું

મારા જુના મતના ભાઈઓને મારી વિનંતી છે કે જો તમોને ઈમામશાહને માનવાનું હોય તો કેરોડ પીર તથા હાજીપીરને માનો છો તેમ પીર તરીકે માનો પરંતુ ધર્મ ગુરૂ તરીકે અને હિંદુ ગણીને તો નહિજ માનતા. તમો કહેશો કે

KJ- BK- 4- 47

realpatidar.com

ધર્મની નીંદા કરો છો પરંતુ એ ધર્મ પાખંડી છે એ ધર્મ હિંદુ નથી તેમ કુરાની
પણ નથી. એકે ધર્મ વગર ધરમમાં તમો લટકી રહ્યા છો તો એવા ધર્મનો ત્યા
ગ કરી ગમે તે એકે ધર્મને માન આપો આઠ દશ ગાઉથી જ્ઞાતિનાં ભાઈ બહે
નો આવીને ઉપદેશ શ્રવણ કરે છે. અને ભગવાનને ભેર ધરે છે તે ઉત્સાહ
વગર કયાંથી હોય. તો બીજા ગામવાળાઓને આટલો ઉત્સાહ છે જ્યારે
તમો અંધારામાંજ ઘોરી રહ્યા છો. એ ઈચ્છનીય તો નજ ગણાય. આપણે
જેવા કુટુંબી છીએ અને કુટુંબીજ રહેશું ભક્ત પ્રહલાદ ને પોતાનો ધર્મ સાચ
વવામાં કેટલાં સંકટો પડયાં હતાં પરંતુ તેઓ ડગ્યા નહિ અને છેવટે તેમ
નોજ જય થયો.= શગાળશાનું દ્રષ્ટાંત-: ર

શગાળશા આગલા અવતારમાં કર્ણ હતા અને દાનેશ્વરી કર્ણ તરીકે આ
જ આખા દુનિયામાં દાનેશ્વરીમાં તેઓ અજોડ હતા. તો આપણને પણ
આવા દ્રષ્ટાંતો નજર સન્મુખ રાખી કાર્ય કરવાનું કે આપણી જ્ઞાતિ એ
છે તે પવિત્ર છે. ફક્ત તેમાં પડેલી ભૂલો કાઢવાની આપણી ફરજ છે અને
તે કાઢવુંજ ધર્મ માટે માથાનું દાન આપવું પડે તો પણ આપણે તેમ કરવા
તૈયાર રહેવું જોઈએ. હિંદુ ભાઈઓને જે વસ્તુની તો ખાસ જરૂર છે એકતો ગૌરી અને
મિતા આ બે વસ્તુઓ આપણા જુના મતના ભાઈઓમાં નથી. પરંતુ આપણે નમ્ર
તાથી સમજાવતા જશું તો આપણી વિનંતીને તેઓ જરૂર આવકાર આપશે. આપણા
વડીલોએ જે પંથ અપનાવ્યો છે તે હિન્દુ નથી. ૧૯૩૨ માં આપણા વડીલોએ બ્રા
હ્મણોનો ત્યાગ કર્યો અને તેથીજ આજે આટલી અધોગતિ પામ્યા છીએ.
ભગવાન ભક્તોને વશ છે આપણા કાર્યમાં સાચી સેવા છે અને કુદરત આપણી સાથે
છે ઈશ્વરે આપણને ધર્મમાંથી સડાઓ કાઢવાની પ્રેરણા કરેલી છે હું ચૌદ વરસ
નો હતો ત્યારથી પ્રચાર કાર્યમાં રસ લઉં છું પરંતુ હમણાં પ્રાણ વરસથી જે સહાયતા
મળી છે અને પ્રચાર કાર્ય આગળ વધી ગયું છે તે ખરેખર આવકાર દાયક ગણાય.
આવા કાર્યમાં જો બહેનોનો સાથ નહિ હોયતો બહુજ દુઃખ સહન કરવાં પડે છે પુરુષો
ને પુરુષોને સ્ત્રીઓના સાથની ખાસ જરૂર હોય છે તો મારી બહેનોને મારી ખાસ વિનંતી
છે કે તમારા પતીને પ્રભુ તુલ્ય માની. તેઓના કાર્યમાં જોડાઈ જજો. તમારાં માવીત્રો અ
જ્ઞાન હોય અને કદાચ તમારો ત્યાગ કરે અને પોતાને ઘેર ન આવવા દે. તમારાં સાસુ
સસરો અજ્ઞાનતાને લીધે તમને સતાવે તો પણ તમે તમારો ધર્મ મુકશો નહિ.
આપણી અજ્ઞાન જ્ઞાતિમાં બાળ લગ્નની પ્રથા કેટલી ખરાબ છે. બાળ લગ્નથી કેટલાંક
કજોડાં થાય છે અને તેને લીધે આપણી કેટલી બધી અધોગતી થાય છે તો
આપણે સમજી શકતા નથી. તેનું કારણ કે આપણે અજ્ઞાન છીએ હાલના
જેતરમાંજ અહીં આજુ બાજુના ગામોમાં છૂટા છેડા થયા છે તેનું કારણ

રતનશી બાપા ૧૪ વર્ષની ઉમરે ધર્મનું કામ શરૂ કરેલ.

realpatidar.com

KJ-BK-4-48

realpatidar.com

બાળ લગ્ન. જો બાળ લગ્નનો રીવાજ ન હોય તો છુટાછેડા કરવાનો વખતજ ન આવે આપણાં પુત્ર પુત્રીનાં સગપણ બાબત આપણે આ બાબતો જાણતાંજ ન હોઈએ અને પરબારાજ બીજાં કરી નાખે છે. તો મારા યુવક બંધુઓને ખાસ વિનંતી કરૂં છું કે. તમારાં બાળકોનાં સગપણ કરવાનું તમારા માવિત્રો પર છોડશો નહિ તમો પરદેશ ગયા ત્યારે તમારાં માવીત્રોને એટલેજ આપીજજો કે અમારાં બાળકોનાં સગપણ કરશો નહિ અને જો કદાચ કરશો તો અમો તે કબુલ કરશું નહિ.

જુના મતના ભાઈઓને તે પંથનો ત્યાગ કરવા બાબત સમજાવેલ હતું. અને એ પંથ હિંદુ નહોતો નથી વગેરે બાબતો સુંદર ભાષામાં સમજ પુર્વક સમજાવતા ગયેલા હતી. દ્રષ્ટાંત. જાણવા છતાં ભુંડાવા બાબત—

બીડી ન પીવાની વિનંતી સાથે પ્રતિજ્ઞાઓ કરેલ હતી. કારણ કે પીરાણા પંથી ભાઈઓ પણ સભામાં હાજરી હતી. — ગાલાવેલા વિષે દ્રષ્ટાંત —

આણંદના ધર્મ અને ફરજ વિષે મહારાણા પ્રતાપના પુત્ર તોફાનો — નારી રક્ષણ તથા માતૃ ધર્મ વગેરેનો સમાવેશ થયેલ હતો. ઉપરોક્ત દ્રષ્ટાંતથી શ્રોતાઓમાં સ્ત્રી વર્ગપર સારામાં સારી અસર થયેલ હતી. હવે વધારે બોલી કિંમતી વખત ગુમાવવા માગતો નથી તમો સર્વે સમજુ છો. અને જે સાંભળેલ છે તેમાંથી સાર ગ્રહણ કરી તે મુજબ વર્તન રાખશો. એમ ઈચ્છું છું બુઢાઓ કે જે આપણી ભાષામાં ગોઢેરાઓ કહેવાય છે તેઓનું રાજ હવે છુપાઈ ગયેલ છે આપણે હવે કાકીથી ડરતા નથી કારણ કે સાચી વાત સમજી ગયા છીએ જહાંગીરી કરનાર આગેવાનો ને હજુ પણ જણાવું છું કે એ પંથ હિંદુનો નથી. જો એ પંથ હિંદુ છે એમજ માનતા હો તો ૯૦ હજાર ની જનતામાંથી. એ પંથ. સાબીતી બતાવવાની હિંમત કોઈમાં નથી. ક્યાંથી હોય. જો સત્ય હોય તોજ જાહેર સભામાં બોલી શકાય. કારણ કે જાહેર સભામાં પ્રભુનો વાસ હોય છે. અને ત્યાં ખોટું ચાલી શકતું નથી. કદાચ કોઈ ખોટું બોલે તોપણ શ્રોતાઓ તે માંથી પરતજ ખરૂં ખોટું તારવી શકે છે એ પીરાણા પંથને માનનારા દરેક ભાઈઓ ને વિનંતી કરીએ છીએ કે તમો એ પંથને નામે ધર્માદાનાણાં આપશો નહિ કારણ કે તમારાં એ નાણાંથી ગાયો અને બકરાં નો વધ થાય છે. અને તેની હત્યા. તમરા શીર પર ચડે છે. આપણે ગૌરક્ષક છીએ. માટે આપણા દાનથી આવાં કૃત્યો થવાં જોઈએ નહિ હવે હું મારૂં બોલવું બંધ કરૂં છું. તાળીઓના ગડગડાટ સાથે પોતાનું સ્થાન. લીધેલ હતું.

શ્રી. કેશવ ભાઈ મનજી નખત્રાણા.

આજની સભા અને ઉત્સાહ જોઈ આનંદ વ્યક્ત કરી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

realpatidar.com

KJ - BK - 4 - 49

શ્રી. રણમલ માવજી ઉખરડા.

અમારા ગામ ઉખરડાનો આજનો દિવસ સોના નો દિવસ ગણાશે તેનું કારણ ધર્મથી જણાવેલ હતું. તેમના કાર્યમાં બીજા ગામના ભાઈઓએ જે સહાયતા આપી હતી તે બદલ આભાર માનેલ હતો. ધર્મના કાર્યમાં કેટલાં દુઃખો સહન કરવાં પડે છે તે વિષે ઈશુ ખ્રિસ્ત નું દ્રષ્ટાંત આપેલ હતું.

માસ્તર વિજયાશંકર નિર્ભયરામ ઉખરડા.

આજ નો મહોત્સવ જોઈ દરેક સનાતની ભાઈ નું હૈયું હર્ષ પામે તેમાં કંઈ નવાઈ નથી. કારણ કે ધર્મમાં પલટો આવતો હોય તો તેની જવાબદારી સંભાળવી તેને શીરે હોય છે. શ્રીમાન રતનસીંભાઈ તો પાટીદારોમાં એક જ છે બીજા કેટલાક ભાઈઓ પણ શક્તિ અનુસાર ભોગ આપી રહેલ છે તે જોઈ આનંદ થાય છે આપણાં બાળકોને કેળવણી ની ખાસ જરૂર છે ભવિષ્ય ની પ્રજા સુધરશે તો જ આપણો આપણી ઉન્નતી સાધી શકીશું. માટે કેળવણીનો પ્રચાર કરો એવી વિનંતી કરી બેસી જાઉં છું.

બારોટ શ્રી. તેજમલજી ગોપાલજી ઉખરડા (જાગીરદાર)

હું કંઈ વિદ્વાન નથી. પરંતુ એક સવૈયો બોલી બેસી જઈશ. દાન કેવે ઠેકાણે કરવું તે વિષે એક સવૈયો બોલી ગયા હતા.

શ્રી. પ્રેમજી માવજી ઉખરડા.

અગાઉથી લખેલ ભાષણ વાંચી સંભળાવેલ હતું. જેમાં ધાર્મિક બાબતો નો સારા પ્રમાણમાં સમાવેશ થયેલ હતો.

શ્રી. ખટાઉભાઈ ખીમજી નખત્રાણા વાળા.

આજ ની સભામાં હાજરી આપનારાઓનો આભાર મારાથી આગ ઉ અનેક ભિન્નો માની ગયા છે જેથી હું આભાર માનતો નથી. આપણાં બાળકોને ધાર્મિક તેમજ વ્યવહારીક શિક્ષણ આપી શકે તેવા શિક્ષકો રોકવાની દરકાર. નખત્રાણા વોલીન્ટીઅરો નો સંગઠન શ્રી પંચાયમાં પણ નથી સમજવાણી. અને અત્રેના આ પાણી ની સગવડ નથી સમજાતી. એમ જણાવી. આરસ પરસ એકતા વિષે બોલી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

શ્રી વિશ્રામભાઈ રામજી ખોરસરા -

અવાજ નહિ નીકળવાથી બોલી શક્યા નહોતા.

શ્રી. તેજા ભાઈ વિઘા મથલ.

મનુષ્ય દેહ માં સાર્થક કરવાની ફરજ હોઈ તે કેમ કરવું એમ જણાવેલ હતું.

શ્રી. હરજી ભાઈ વિશ્રામ - મથલ

યુવાન બંધુઓ કે જે પરદેશ આવજા કરે છે તે જ્યાં ત્યાં ખાય છે. માટે તેમ કરવું ન જોઈએ અને ખાવાનું ઘેરથી બનાવીને સાથે રાખવાં

KJ- BK - 4 - 50

realpatidar.com

ન જણાવેલ હતું. પરદેશ માં નાત જાત જોયા વગર જમવું નહિ એમ જણાવેલ હતું.

શ્રી. મનજી ભાઈ વાલજી ઉખરડા.

અરસપરસ પ્રેમ રાખવા વિષે બોલ્યા હતા. અને આપણે આપણી જાતને પોતેજ ઓળખતા થઈશું. એમ જણાવી બેસી ગયા હતા.

શ્રી. મુળજી ભાઈ શીવજી બાંભડીવાળા

આજની સભામાં અત્યાર સુધી લગભગ સત્તર ભાઈઓ ~~ઉભા~~ પોતાના વિચારો જણાવી ગયેલ છે. અને હવે સૌથી છેલ્લે હું બોલવા ઉભો થયો છું એટલે ખાસ ચર્ચવા લાયક વિષય એક પણ મારી નજર સામે આવતો નથી. છતાં પણ એક વિષય ખાસ જણાવું છું કે હજુ આપણા એંશી હજાર બંધુઓ અજ્ઞાનતા સેવી રહેલ છે તેઓની સુધારણા માટે આપણને ઘણા કાર્ય કરવાની જરૂર છે. ઉત્સાહી નિરઅભીમાની અને માયાળુ જો કાર્ય કરો ત્યારે નહિ હોય તો આપણું કાર્ય જલ્દી બની શકશે નહિ. આપણું રાજકાજનું યુદ્ધ નથી પરંતુ ધર્મ યુદ્ધ છે અને તેમાં કેટલો સમય વ્યતીત થશે તે કોઈ પણ કળી શકે તેમ નથી. આજે લગભગ ચાળીસ વરસથી આ યુદ્ધ ચાલે છે છતાં પણ આપણામાં એકતા આવેલ નથી. તેનું કારણ કે આપણા હૃદયમાં ઘર કરીને બેઠેલ ઝેર ઓજ. — કેટલેક ઠેકાણે આપણા કાતિ પંથના શ્રીમંદા પૈસો. કોર્ટના આશરા લેવામાં વેડફાઈ રહેલ છે તે ગમતું નથી કે જણાતું નથી તેવીજ રીતે મારા તમામ બંધુઓને પણ રુચતું નહિજ હોય. વળી મને કેટલાક અજ્ઞાન બંધુઓ એમ કહે છે કે સનાતન ધર્મમાં શું ચમત્કાર છે તો તેવા બંધુઓને મારી વિનંતી છે કે આ ધર્મ કંઈ મદારીઓની માફક હાથ ચાલાકી અને ચમત્કાર બતાવનારો નથી પરંતુ મોક્ષના માર્ગે લઈ જનારો છે. લગભગ સાતસો વરસ ઉપર હિંદુ ધર્મ પર મુસલીમ રાજ્યો તરફથી કેટલી બધી સતામણી કરી રહેલ હતા અને તે વખતે પણ ધર્મવીરોની મદદમાં સાક્ષાત પરમાત્મા હતા અને સનાતન ધર્મનો ઝંડો સદાય સાબુત રહેલ છે. તે આપણે અમર ઈતિહાસો પરથી જાણી શકીએ છીએ. મારા અજ્ઞાન સતપંથી ભાઈઓને વિનંતી કરું છું કે - ~~ધર્મ~~ ધર્મવીરોના ઈતિહાસો વાંચો. અસ્તુ

૮૦ હજાર સતપંથી હતા, ત્યારે..

૪૦ વર્ષ

શ્રી. ઉમર લાલભાઈ જોસી.

મિત્રો-

હિન્દુ એટલે શું. કડવા પાટીદાર જ્ઞાતિના ઉછાંછળા બાળકોમાં પોકી. ફેલ એવા માં આવે છે.

realpatidar.com

KJ-BK-4-51

realpatidar.com

હરજી ભાઈ અજ્ઞાનતાથી ખોટી થયા છે એટલે આપણે તેમને ક્ષમા આપવી જોઈએ. આપણે પ્રેમ આર્યો હતા. ચાર વર્ણ અને ચાર જાતી હતી.

બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-અને શુદ્ર હિન્દુસ્થાનમાં આવ્યા પછી આપણા વચ્ચે ભત ભતના વિભાગો પડ્યા. એ ભાઈઓ હિંદુ સમાજ પર મોટો આક્ષેપ રાખ્યો તે પણ અજ્ઞાનતાથી આત્મા આપણો નથી આત્મા તો ઈશ્વરનો અનામત છે. આપણા વિચારો શુદ્ધ રાખશો તો કોઈ પણ દુર્ગુણો આવશે નહિ ધર્મમાં ધતીંગ ચીજ ઉત્પન થાય છે ધર્મો બતાવવાની શક્તિ તેજ પુરતી રહેશે. તમારી જ્ઞાતિ અધોગતીએ પહોંચી છે તેમાં ઈમામ શાહનો એટલો બધો દોષ નથી પરંતુ ૨૫૦ વરસથી જ્યારે ભાર બારહાને છોડ્યા ત્યારેજ તમારી અધોગતી થઈ. મુસ્લીમ જાતિમાં ભેદ ભાવ નથી ક્રિશ્ચીયનોમાંપણ નથી. સનાતન ઝંડાને રાખવાનો અધિકાર એકેજ જ્ઞાતિને નથી પરંતુ સમસ્ત હિંદુઓનો છે. તમો તમારી જ્ઞાતિના દુર્ગુણો પર ભલે બોલો પરંતુ આખા હિંદુ સમાજ પર આક્ષેપ ~~છોડવા~~ મુકતા નહિ

શ્રી. રતનસીભાઈ ખીમજી પોશાણી.

આજની સભાનું કાર્ય આપણને જે ઉત્સાહથી. કરવું જોઈએ તેટલુંજ ઉત્સાહથી થયેલ છે શ્રીમાન બેચરલાલ ભાઈએ એક ભાઈના બોલવા સામે વિરોધ બતાવેલ છે તો તેઓશ્રીને મારી ખાસ વિનંતી છે કે અમારા બોલવામાં અજ્ઞાનતાને લીધે કંઈક ભૂલ થાય તો આપ ઉદાર દીલ રાખી. ક્ષમા કરશો અને બોલનાર યુવકોને પણ ભણાવવાનું કે તે આપશ્રીનો ગુરૂ સમજી બોલવાની તાલીમ લેશે. એમ ઈચ્છું છું અને આપ સર્વે ભાઈઓ જેમ અત્યાર સુધી કરેલ છે તેવીજ રીતે આવતી કાલ વિગેરે સુધી ઉત્સાહથી કાર્ય કરશો એવી આશા રાખું છું.

શ્રીમાન બેચરલાલ. ભાઈ જોશી.

મિત્રો.

હું જે બોલું છું તે વ્યક્તીગત નહિ પણ જનરલી બોલું છું realpatidar.com બોલવાથી કોઈનું દીલ દુભાયું હોય તો દરગુજર કરશો. સનાતન ધર્મકી જય.

-સમાપ્ત-

સભામાં હાજરી. ૨૫૦૦ માણસોની આશરે

સમય-૧૧ વાગે રાતના.

પ્રમુખની સહી.

પટેલ-વાલજી બાપુ ભગત ની સહી

દા: પોતાના.

KJ- BK- 4- 52

realpatidar.com

૧૩૦

ઉખરડા તા. ૨૩-૫-૬૪

ભગવાન ની પ્રતીષ્ઠા થયા ને દિવસે – સમય – ૯।। ૧૧ સવારના

જાહેર મેળાવડાનો

રિપોર્ટ

પ્રમુખની દરખાસ્ત મુકનાર — શ્રી. રતનશી ભાઈ ખીમજી વીરાણી વાળા.

ટેકો આપનાર — શ્રી. માવજી ભાઈ ધનજી નખત્રાણા વાળા.

પ્રમુખ —: શ્રી. ડાહ્યા ભાઈ રતના ઉખરડા વાળા.

શ્રી. રતનશી ભાઈ – પ્રમુખ થતી.

સમાજનો નો આપેલ સેવા બદલ આભાર માની જણાવેલ હતું કે તમોએ જેવો સાથ અને સહકાર અત્યાર સુધી આપેલ છે તેવો જ ઠેઠ સુધી પણ આપશો એવી. વિનંતી કરું છું શ્રીમાન ઉમર લાલ ભાઈ જેવા વીરવર આપણી શાંતિ માટે જે કામ ઉઠાવી રહેલા છે તે બદલ આપણે તેઓ શ્રીના ઋણી છીએ અને તેઓ આપણને આપણું કર્તવ્ય સમજાવશે એવી આશા રાખું છું.

શ્રીયુત. ઉમર લાલ ભાઈ જોશી- વિરાણી.

મિત્રો અને બહેનો.

મને ઘણા ભાઈઓ મહારાજ કહીને સંબોધે છે, તેઓની સામે હું વિરોધ બતાવું છું મહારાજ એટલે રાજાઓના પણ રાજા મહારાજ શબ્દ યોગ્ય માણસને જ શોભે. હવે ધર્મ બાબત જે કહેવું બોલીએ તે રહ્યું એ હું જ છે તો આપના કિંમતી વખતનો વધારે ભોગ ન લેતાં મારૂં બોલવું હું ટુંકમાંજ પતાવીશ. આ શુભ પ્રસંગે પ્રભુ કાર્યમાં બનતો ફાળો આપવા સુચના કરેલ હતી. શ્રી માન રતન સી ભાઈ ને ધર્મવીર નું સંબોધન આપી. તેઓના ફોટા ની અકેક કોપી. દરેક ગામ ના સનાતની ભાઈઓ. પોત પોતાના મંદીરોમાં રાખશે. એવી દરખાસ્ત મુકી હતી જેનો સમાજના એ તાળીઓના ~~આ~~ ગડગડાટ થી વધાવી લીધેલ હતી.

રતનશી
બાપાને
ધર્મવીરની
ઉપમા

realpatidar.com

માસ્તર વિજયાશંકર નિર્ભયરામ- ઉખરડા-

શ્રી માન ઉમરલાલ ભાઈના ભાષણ ને ટેકો આપેલ હતો. સ્વયં સેવકોનું સેવા કાર્ય જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો

શ્રી. મુળજી ભાઈ શીવજી ખોંભડી વાળા.

મારા પહેલાં બોલી જનાર શ્રીમાન ઉમરલાલ ભાઈ તથા માસ્તર સાહેબના ભાષણ ને અનુમોદન આપતા જણાવેલ હતું કે એ વીરનર નો છબી ફોટો આપણા દરેક મંદીર માં જરૂર રાખવું એમ જણાવેલ હતું.

જય નાદ ના પોકારો થયેલ હતા.

KJ-BK-4-53

realpatidar.com

શ્રી. રતનશી નારાણ જોંભડી વાળા.

મારા સુપક બંધુઓને મારી ખાસ વીનંતી છે કે શ્રીમાન રતનશી ભાઈને તેઓના નામની આગળ ધર્મવીર નો ઈલ્કાબ આપી સંબોધશો. બોલો ધર્મવીર શ્રી. રતનશી ભાઈનો જય.

શ્રીમાન ઈશ્વરલાલ ભાઈ-

મિત્રો.

મારી દરેક ભાષણોમાં મારા વડીલ બંધુ રતનશી ભાઈનો ફોટો રાખવાની અપીલ હતી પરંતુ આપ સર્વે ભાઈઓએ તો તેના કરતાં પણ વિશેષ કાર્ય કરીને મારા અપીલને વધાવી લીધી છે તે બદલ આપનો આભાર માનું છું.

શ્રી. રતનશી ભાઈ.

આટલું બધું માન મારે માટે અતીશયોક્ત ગણાય માટે તેમ ન કરશો એવી આપ સર્વે ભાઈઓને વિનંતી કરું છું.

પ્રતિષ્ઠા કાર્યની શરૂઆત

શીખર ચઢાવનાર —:	કોરી. ૧૧૦૧	શ્રી. જેઠાભાઈ	નાનજી	ઉખરડા વાળા.	
ધજા ચઢાવનાર —:	" ૧૧૫૧	" રતનાભાઈ	લધા.	ઉખરડા વાળા.	
મૂર્તિ પધરાવનાર —:	" ૧૫૫૧	" યુવરાજભાઈ	ગાંગા	કોટડા (જડોદર) વાળા.	
ગણપતી " —:	" ૧૨૫૧	" દેવજી ભાઈ	રતનશી	ઉખરડા વાળા.	
હનુમાનજી " —:	" ૯૦૧	" માવજી ભાઈ	નાનજી	ઉખરડા વાળા.	
ગરૂડજી " —:	" ૮૫૧	" યુવરાજ વાલજી નાં	માતુશ્રી જનબાઈ	ઉખરડા વાળાં	
ભગવાન નો હાર-૧ "	૭૫૧	" રામજી ભાઈ	જેઠા	ઉખરડા વાળા	
" " ૨જો "	૬૫૧	" શીવજી ભાઈ	રામજી	ઉખરડા વાળા.	
" " ૩જો "	૭૦૧	" માનણ ભાઈ	હંસરાજ	ઉખરડા વાળા.	
લક્ષ્મીજીનો હાર-"	૬૦૧	" દેવજી ભાઈ	અખૈ	ઉખરડા વાળા.	
છત્ર ચઢાવનાર-"	૫૦૧	" ખીમજી ભાઈ	શીવજી	નખત્રાણા પૂર્વ નિવાસ-વાળા.	
આરતી-૧લી "	૫૦૧	" કરશન ભાઈ	રામજી	ઉખરડા વાળા.	
" ૨જી "	૪૦૧	" ડાહ્યાભાઈ	રતના	ઉખરડા વાળા.	— પ્રમુખ.
" ૩જી "	૩૫૧	" દેવજી ભાઈ	રામજી નાં માતાજી	ઉખરડા વાળા	
ચમર ઢાળનાર-"	૩૦૧	" રામજી ભાઈ	વીરજી	ઉખરડા વાળા.	
ઘંટ વગાડનાર-"	૩૦૧	" પરબત ભાઈ	ભીમજી	ઉખરડા વાળા.	
ભોગ ધરાવનાર-"	૪૦૧	" લાલજી ભાઈ	પુંજા	ઉખરડા વાળા.	

કુલ કોરી- ૧૨૨૬૭

realpatidar.com

સભામાં હાજરી ૫૦૦ માણસોની આશરે હતી. KJ-BK-4-54
ખરડો માલુ કરવામાં આવેલ હતો.

સમાપ્ત — સમય સવારના ૧૧ વાગે.

પ્રમુખ — પટેલ હાઈઆરતના બી સાઈ દા: બારોટ તેજમાલ ગોપાલજીના

realpatidar.com

ખુશ ખબર

સભા સમાપ્ત થયલે ખબર મળ્યા કે પીરાણા પંથી ભાઈઓ એ ખાના માં આરતી ઘગાડવા માટે વોલીન્ટીઅરો ની માગણી કરવાથી ગણ જણ આરતીઓ લઈને ત્યાં સેવા કાર્ય માં હાજર થયા હતા. સેવા ધુપેડા ને બદલે પંચવટી થી કરવામાં આવેલ હતી. અને ગોળીને બદલે અર્ગામૃત માં ગંગાજળ નો વપરાશ કરવામાં આવેલ હતો. તથા ભગવાન ની ભેરના ખરડા માં પણ જ્યોતિસ ધામના ભાઈઓ તરફથી કોરો ૧૨૫) મંડાવેલ હતી. જે તરતજ રોકડી આપવામાં આવેલ હતી. મીટીંગ ખલાસ થતાં જ્યારે પ્રમુખશ્રી. તથા શ્રી. જેમરલાલ ભાઈ વગેરે જ્યારે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે જ્યોતિસ. ધામની જગ્યાએ મુસલમાની નેજા ને બદલે ॥ૐ॥ લખેલી ધજા ફરકી રહેલ હતી. ને જોઈ આનંદમાં વૃદ્ધિ થયેલ હતી. અને પીરાણા પંથી ભાઈઓ તરફથી જણાવવામાં આવેલ હતું કે ઉપરોક્ત ફેરફાર આમોએ આજેજ કરી નાખેલ છે અને હાથી જેમાસ પછી વધારે શુભ સમાચાર સાંભળશો કે ઉખરડામાં પાટીદાર ભાઈઓમાં જે વિભાગ નથી પડા એકના છે. અસ્તુ-

ના.૩૦

ખાનામાં ભાગીરથી પૂજા કરવા માટે કાકીઆય ના નામ મોઘ મુખી વીરજી વગેરે આગેવાનો પધારેલ હતા. પણ ખાનામાં ગોળીનો બદલે ગંગાજળ વપરાતું જોઈને તથા આરતીઓ વગેરે ફેરફાર થવાથી રીસાઈને નાસી ગયા હતા. પરંતુ અહીંના પીરાણા પંથી ભાઈઓએ. આ અજ્ઞાન મુખી જતી રહ્યા ત્યાં સુધી સેવા કાર્ય મુલત્વી રાખવાની ઉદારતા બતાવી. તેમને ભોજન કરાવ્યું હતું. ઉપરોક્ત મુખી જમીને તરતજ પલાયન કરી ગયા હતા. ગાડીના બધા પીરાણા પંથી બંધુઓ. સેવા લઈ રહ્યા બાદ ગયા હતા.

ઉમૈયા માતકી જય—

realpatidar.com